

SHARAD P. RANA
Advocate

OFFICE :
103, Kaveri Complex, First Floor,
Newera, BHAYNAGAR-1.
Ph.(0) 8278-251851
E-mail: sprmsadv@gmail.com

Dated 03/04/2012

To,
Vraj Plaza Pvt. Ltd.
36, Dharam Palace,
Chitranjan Chowk,
Vidhyanagar, Bhavnagar,
364001.

REG :- Title Opinion of immovable property of
Non agricultural land of plot No.1 to 13 Net land
adm. 3375.90 sq. mt. total land admeasuring
5059.00 sq. mt. with proposed construction
thereon adm. 6824.50 sq. mt. bearing revenue
survey No.4paiki-4 situated at village Akwada,
tal: & dist: Bhavnagar

We have investigated the title over the property described above in the light of the documents produced before us as also the information furnished to us, and our personal opinion in the matter is as under:

It appears from the file produced before us that in view of the family partition the land of 4paiki, 45paiki, 51paiki, 52paiki, 111paiki, 115paiki, 123paiki & 112paiki admeasuring 1 Acre 10 Gutha, 1 Acre 38 Gutha, 2 Acre 16 Gutha, 1 Acre 17 Gutha, 1 Acre 00 Gutha, 0 Acre 23 Gutha, 5 Acre 15 Gutha, 0 Acre 32 Gutha respectively came into the share of Rupbaiiben Dayabhai and others vide entry No.984 dated 04/08/1994 of record of rights village form No.6. The above entry No.984 was not confirm and the same was taken in dispute register therefore the party applied before the Mamlatdar against the decision of above entry, the Mamlatdar of Bhavnagar Taluka vide its order dated 05/10/1995 confirmed the above entry No. 984.

The Revenue authority has issued village form No.7/12 & 3/A in the name of Rupbaiiben Dayabhai, Manuben Dayabhai, Kanuben Dayabhai, Fuliben Dayabhai, Anjuben Dayabhai, Minaben Dayabhai and Dholiben Dayabhai for the above mentioned land. Out the above, co-owners Dholiben Dayabhai died intestate on 18/07/2006 and her name was deleted from the revenue record vide entry No.2081 dated 13/12/2010 of record of rights village form No.6. The Mamlatdar, Bhavnagar certified the said entry on 06/03/2011.



SHARAD P. RANA
Advocate

OFFICE :
103, Kaved Complex, First Floor,
Harapara, BHUVNAGAR-1.
Ph.(O) 0278-2519061
E-mail: sprana.ad@gmail.com

page-2

Shri Rupbaiben Dayabhai and others had availed loan facility from Akwada Co.Op. Society Ltd., Bank of India, Avaniya Branch, Gujarat State Co-Operative Land Development Bank Ltd., Bhavnagar Branch and charge of the said institutions over the land of various survey numbers including R. S. No.4paiki-4 were noted in village form No.6. The outstanding dues of said Akwada Co.Op. Society Ltd., Bank of India, Avaniya Branch, Gujarat State Co-Operative Land Development Bank Ltd., Bhavnagar Branch were cleared by the land holders as per its No-due certificates recorded in village form No. 6 on 13/12/2010 vide entry No. 2080. The said entry was certified by Mamlatdar, Bhavnagar on 26/2/2011.

One Anandbhai Boghabhai Solanki then entered into agreement to purchase the land of survey No.4paiki-4 adm. 00-50-59 sq. mt. with Shri Rupbaiben Dayabhai, Manuben Dayabhai, Kanuben Dayabhai, Fuliben Dayabhai, Anjuben Dayabhai and Minuben Dayabhai under the registered agreement to sale No.2905 dated 18/12/2009.

The above land of survey No. 4paiki-4 was a piece land and therefore permission was required to be obtained from the revenue authority for sale, accordingly the Deputy Collector vide its order dated 13/01/2010 granted permission to sale the above piece land and therefore the transaction for sale was approved in revenue record vide entry No.2090 dated 04/02/2011.

Shri Rupbaiben Dayabhai, Manuben Dayabhai, Kanuben Dayabhai, Fuliben Dayabhai, Anjuben Dayabhai and Minuben Dayabhai then entered into agreement to sale out the agricultural land admeasuring 5059.00 sq. mt. forming part of Revenue Survey No.4paiki-4 with Shri Anandbhai Boghabhai Solanki and hand over possession of the said land vide registered agreement for sale No.5051 dated 06/12/2010 (registered with full stamp) and on receiving the full payment of consideration price the land holders through their power of attorney Shri Anil Bipinchandra Shah executed a registered sale deed No.5051 dated 06/12/2010. The mutation of the said land of R.S. No.4paiki-4 in the name of Anandbhai Boghabhai Solanki at the revenue record was effected on 04/02/2011 as seen from the entry No.2091 of record of rights village form No.6. The Mamlatdar, Bhavnagar (Rev.), certified the said mutation entry on 05/05/2011. The revenue authority has also issued village form No.7/12 & 8/A in the name of Anandbhai Boghabhai Solanki for the land of R.S. No.4paiki-4 admeasuring 5059 sq. mt. The said land of Revenue Survey No.4paiki-4 admeasuring 5059.00 sq. mt. has been converted into non-agricultural land for residential purpose vide order passed by the Collector, Bhavnagar bearing No.Jamin/3/Binkhet/regi No.8/2011-12 on 14-10-2011 on the terms, conditions mentioned in the NA order. The Bhavnagar Area

SHARAD P. RANA
Advocate

OFFICE :
103, Kaveri Complex, First Floor,
Navagurni, BHAYNAGAR 1.
Ph.(O) 0278-2519081
E-mail: sprana.adv@gmail.com

page-3

Development Authority approved the lay-out plan showing sub-plotting of 5059.00 sq. mt. land of Revenue Survey No.4paiki-4 into 13 subplots with common plot and internal common roads on 15/12/2011 vide permission No.BADA/TAKE/100/2009/ S.R./401/VASHI/1003/2010.

The said Anandbhai Boghabhai Solanki then entered into agreement to sale the said plot No.1 to 13 with M/s. Chandra Developers proprietor Ashaben Jibanbhai Shah vide registered agreement to sale dated 10/03/2013.

M/s. Vraj Plaza Pvt. Ltd. then purchased the said land of plot No.1 to 13 from Anandbhai Boghabhai Solanki under the registered sale deed No.787 dated 27/03/2012 in which M/s. Chandra Developers proprietor Ashaben Jibanbhai Shah has also been joined as confirming party.

The revenue authority has also mutated the above land in the name of M/s. Vraj Plaza Pvt. Ltd. and issued village form No.2 & B-A in its name.

You have obtained two separate permission for residential flats bearing permission No.BADA/TEK/480/2013/SR/45/vashi/6028 AND No.BADA/TEK/480/2013/SR/45/vashi/6029 both dated 13/02/2014, the BADA has approved building plan thereunder.

We have carried out the search with the office of Sub-Registrar Bhavnagar-3 for the period from 1999 to 2013 from the available records (original receipt No.2014013000883 dated 02/04/2014 is enclosed) and have not found any subsisting charge registered over the same.

In view of what has been stated hereinabove and as per the record, documents and information submitted before me, I certify that the title of Vraj Plaza Pvt. Ltd. appears as to be clear, marketable, and free from any encumbrance over the land described below:

:: DESCRIPTION OF PROPERTY ::

Non agricultural land of plot No.1 to 13 Net land adm. 3375.90 sq. mt. total land admeasuring 5059.00 sq. mt. with proposed construction thereon adm. 6824.50 sq. mt. bearing revenue survey No.4paiki-4 situated at village Akwada, tal. & dist. Bhavnagar and bounded as under:

North: Remaining land of adj. R.S. No.4paiki-4,
South: Adjoining R.S. No.15,

Residence - Plot No. 3/B, Bhagyoday Society, Near Tilaas Jakatnaks, BHAYNAGAR.



SHARAD P. RANA
Advocate

OFFICE:
103, Kaveri Complex, First Floor,
Rampura, BHAVNAGAR-1.
Ph.(O) 0275-2519051
E-mail:spina.adv@gmail.com

page-4

East: Avniya Road and Cart Road 10.00 mt.,
West: Adjoining R.S. No.5.

Bhavnagar

Dated: 3rd day of April 2014.


[Sharad P. Rana]
Advocate



주요 연구 실적

સેકશન, ઘડેલ ૨, સર્વે નં. ૪ પેજ ૪, પ્લોટ નં. ૧૧૩.

Search in: **WISCONSIN**

ਘੋੜੇ ਜੰਗਲ

© 2004 Blackwell Publishing Ltd

34799 34800

2024-09-09

Keywords: social support; coping strategies; self-esteem

2000年12月

100

444 65204

इन्ने: अङ्गिका *

एतु अव्यक्तं नाम - भरतः भी. राणा

સાથે જુઓ આ બોર્ડર

主 題

2000-2001

અન્ય સ્થળો પરથી સંગ્રહિત / ડાઉનલોડ

1

કેલેન્ડર-આવૃત્તિ સર્વેક્ષણ નોંધ

2004-05

જાણી મારા જાણીમાં (૨૦૧૧-૧૨ થી ૧૭)

1

સાથે જોડાયેલ છે.

Yoon

102

552

1

電話 03-5454-2741

<http://www.elsevier.com/locate/jnlp>

448 2050

Figure 2

આ શિલાલેખની અસાધ્યતાની કિં

20413

150

સાથે જાણવું જોઈએ કે આ

© 2004 Blackwell Publishing Ltd

આ દિગોળે સંભાર આપે અને

2. *Arctostaphylos uva-ursi* (L.) Spreng.

1994

4444

2008年12月11日

સામાજિક સુધારાના દૃષ્ટાંતથી જીવિતના સરખાને પોતાના

[illegible]344 *Journal of Management Education* 34(3)

Source: U.S. Bureau of Economic Analysis.

ICR-MC

A771773700090249173

Y. J. Fan et al.

37/49 (92%)

Ph. : G. 2518523, 2519149
Ph. : R. 2420881, 2510881
M. : 9377100594, 982520794

Vraj Plaza Private Limited

Dharam Palace, Plot No. 36, Chitranjan Chowk, Vidhyanagar, Bhavnagar - 364 002. (Gujarat)

Ref. No. :

Date :

CERTIFIED TRUE COPY OF THE RESOLUTION PASSED BY THE BOARD OF DIRECTORS OF VRAJ PLAZA PRIVATE LIMITED AT THE BOARD MEETING HELD AT THE REGISTERS OFFICE OF THE COMPANY AT PLOT NO.36, DHARAM PALACE CHITRANJAN CHOWK, VIDHYANAGAR, BHAVNAGAR-364002 ON 7TH APRIL, 2014 AT 11.00 A.M.

"RESOLVED THAT the company hereby authorized that Mr. Pankaj B. Shah or Vipul B. Shah is hereby authorized to sign and execute any of the agreement to sale or any of the sale deed regarding the above company's property which may be required in this context by the related department."

For, VRAJ PLAZA PVT. LTD.


Pankaj B. Shah
DIRECTOR

CERTIFIED TRUE COPY

2-7-1971-11-11-2

संविधान - अनुच्छेद 11, 14, 19, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 150, 151, 152, 153, 154, 155, 156, 157, 158, 159, 160, 161, 162, 163, 164, 165, 166, 167, 168, 169, 170, 171, 172, 173, 174, 175, 176, 177, 178, 179, 180, 181, 182, 183, 184, 185, 186, 187, 188, 189, 190, 191, 192, 193, 194, 195, 196, 197, 198, 199, 200, 201, 202, 203, 204, 205, 206, 207, 208, 209, 210, 211, 212, 213, 214, 215, 216, 217, 218, 219, 220, 221, 222, 223, 224, 225, 226, 227, 228, 229, 230, 231, 232, 233, 234, 235, 236, 237, 238, 239, 240, 241, 242, 243, 244, 245, 246, 247, 248, 249, 250, 251, 252, 253, 254, 255, 256, 257, 258, 259, 260, 261, 262, 263, 264, 265, 266, 267, 268, 269, 270, 271, 272, 273, 274, 275, 276, 277, 278, 279, 280, 281, 282, 283, 284, 285, 286, 287, 288, 289, 290, 291, 292, 293, 294, 295, 296, 297, 298, 299, 300, 301, 302, 303, 304, 305, 306, 307, 308, 309, 310, 311, 312, 313, 314, 315, 316, 317, 318, 319, 320, 321, 322, 323, 324, 325, 326, 327, 328, 329, 330, 331, 332, 333, 334, 335, 336, 337, 338, 339, 340, 341, 342, 343, 344, 345, 346, 347, 348, 349, 350, 351, 352, 353, 354, 355, 356, 357, 358, 359, 360, 361, 362, 363, 364, 365, 366, 367, 368, 369, 370, 371, 372, 373, 374, 375, 376, 377, 378, 379, 380, 381, 382, 383, 384, 385, 386, 387, 388, 389, 390, 391, 392, 393, 394, 395, 396, 397, 398, 399, 400, 401, 402, 403, 404, 405, 406, 407, 408, 409, 410, 411, 412, 413, 414, 415, 416, 417, 418, 419, 420, 421, 422, 423, 424, 425, 426, 427, 428, 429, 430, 431, 432, 433, 434, 435, 436, 437, 438, 439, 440, 441, 442, 443, 444, 445, 446, 447, 448, 449, 450, 451, 452, 453, 454, 455, 456, 457, 458, 459, 460, 461, 462, 463, 464, 465, 466, 467, 468, 469, 470, 471, 472, 473, 474, 475, 476, 477, 478, 479, 480, 481, 482, 483, 484, 485, 486, 487, 488, 489, 490, 491, 492, 493, 494, 495, 496, 497, 498, 499, 500, 501, 502, 503, 504, 505, 506, 507, 508, 509, 510, 511, 512, 513, 514, 515, 516, 517, 518, 519, 520, 521, 522, 523, 524, 525, 526, 527, 528, 529, 530, 531, 532, 533, 534, 535, 536, 537, 538, 539, 540, 541, 542, 543, 544, 545, 546, 547, 548, 549, 550, 551, 552, 553, 554, 555, 556, 557, 558, 559, 560, 561, 562, 563, 564, 565, 566, 567, 568, 569, 570, 571, 572, 573, 574, 575, 576, 577, 578, 579, 580, 581, 582, 583, 584, 585, 586, 587, 588, 589, 590, 591, 592, 593, 594, 595, 596, 597, 598, 599, 600, 601, 602, 603, 604, 605, 606, 607, 608, 609, 610, 611, 612, 613, 614, 615, 616, 617, 618, 619, 620, 621, 622, 623, 624, 625, 626, 627, 628, 629, 630, 631, 632, 633, 634, 635, 636, 637, 638, 639, 640, 641, 642, 643, 644, 645, 646, 647, 648, 649, 650, 651, 652, 653, 654, 655, 656, 657, 658, 659, 660, 661, 662, 663, 664, 665, 666, 667, 668, 669, 670, 671, 672, 673, 674, 675, 676, 677, 678, 679, 680, 681, 682, 683, 684, 685, 686, 687, 688, 689, 690, 691, 692, 693, 694, 695, 696, 697, 698, 699, 700, 701, 702, 703, 704, 705, 706, 707, 708, 709, 710, 711, 712, 713, 714, 715, 716, 717, 718, 719, 720, 721, 722, 723, 724, 725, 726, 727, 728, 729, 730, 731, 732, 733, 734, 735, 736, 737, 738, 739, 740, 741, 742, 743, 744, 745, 746, 747, 748, 749, 750, 751, 752, 753, 754, 755, 756, 757, 758, 759, 760, 761, 762, 763, 764, 765, 766, 767, 768, 769, 770, 771, 772, 773, 774, 775, 776, 777, 778, 779, 780, 781, 782, 783, 784, 785, 786, 787, 788, 789, 790, 791, 792, 793, 794, 795, 796, 797, 798, 799, 800, 801, 802, 803, 804, 805, 806, 807, 808, 809, 810, 811, 812, 813, 814, 815, 816, 817, 818, 819, 820, 821, 822, 823, 824, 825, 826, 827, 828, 829, 830, 831, 832, 833, 834, 835, 836, 837, 838, 839, 840, 841, 842, 843, 844, 845, 846, 847, 848, 849, 850, 8

0120-7074-2010-011

[illegible]

[Signature]

ગોળે - બહારના નમુનો - જાણી - બાવનનર

ગામનો નમુનો નંબર - ૮-૪ ઉપરથી નકલ

માન્ય નંબર - ૮૩૩

નામ: વૃક્ષરક્ષા કો. પ્રા. લી. શ્રી પંડિતજીભાઈ ભુસારનાથ કાંઈ

નમુનો ૧ આવર ૩ માંની નોંધ નંબર	નમુનો ૨ ના આધાર નંબર ના નમુનો નં	સર્વે નંબર	ખેડે નંબર	સેપ્કમ (ગોમી)	મોનિટરીંગ રકમ					
					આવર આવર જુદી	ફિલ્મી વર્ષીનું નુસાન ના મોડેલ ફી	કા.પં. ઉપર	વિભાગ ઉપર	મ +૫	સંકુલ વર્ષીન મોડેલની રકમ
1	2	3	4	5	6	7	8	9	10	11
	વૃક્ષરક્ષા કો. પ્રા. લી. કાંઈ	૪૩૩	૨૩૩૩ ૨	૨૩૩૩ ૨૩૩૩	૪૩૩/૩					
વૃક્ષરક્ષા કો. પ્રા. લી. કાંઈ					 મોડેલની રકમ ૪૩૩/૩					



રાજ્ય ગુજરાત GUJARAT

730958


27 MAR 2012

સંખ્યા 730958
 નામ શ્રીમતી રાજીવબેન રામભદ્રા માટે
 એવામાં રૂ. ૧૦,૦૦,૦૦૦/- પરિણામ (૨૦૧૧/૧૨)
 કાનૂની કિંમત રૂ. ૨૫,૦૦,૦૦૦/- મર્યાદિત છે
 જાણીતા વડી જનરલ સેમી

જીવેશ એન. ચાવ. સોમ્ય સેન્ટર ઓ.નં. ૭૩/૭૩, ૨૫, મીટી સેન્ટર સોમ્ય સેન્ટર, કાન્યાવાસ, ભાવનગર. આ સ્ટેમ્પનો ઉપયોગ ૬ માસમાં જ કરી શકાયો.



વેપાલક કસ્ટોડિયન



"ભાવનગર રજીસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટમાં સમ ડીપાર્ટમેન્ટ ભાવનગર-૩, જીલ્લા અને તાલુકા ભાવનગરના મોજે નામ નાકાકાના રેવન્યુ સર્વે નં. ૨૫૬/૧-૨ની કુલ ૫૦૫૮.૦૦ ચોરસ મીટર જમીનમાં રહેલાંકના હેતુઓ માનવમાં આવેલ પ્લોટ નં. ૧ થી ૧૩ જેનું લેવકાન અનુક્રમે ૨૮૨.૩૩ ચો.મી., ૨૫૧.૫૨ ચો.મી., ૨૫૨.૮૮ ચો.મી., ૨૫૫.૮૭ ચો.મી., ૨૮૫.૭૩ ચો.મી., ૨૪૮.૬૯ ચો.મી., ૨૫૬.૭૬ ચો.મી., ૨૪૮.૦૦ ચો.મી., ૨૪૮.૦૦ ચો.મી., ૨૪૮.૦૦ ચો.મી., ૨૪૮.૦૦ ચો.મી., ૨૪૮.૦૦ ચો.મી., ૨૪૮.૦૦ ચો.મી. તથા ૨૮૫.૨૨ ચો.મી મળી કુલ લેવકાન ૩૩૬૩.૦૯ ચો.મી. છે તે પ્લોટ નં. ૧ થી ૧૩ ની જમીનનો વેપાલક કસ્ટોડિયન"

વેપાલક કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/-

સોમ્ય રૂ. ૨,૫૦,૦૦૦/-

શ્રી. જી. સમી. એવાઈડન્સ પેપર કોર્પોરેશન
 સોમ્ય રૂ. ૨,૫૦,૦૦૦/-
 PRAZA PVT. LTD.
 Director



સિદ્ધ ગુજરાત GUJARAT

730959

27 MAR 2012

[illegible]

જીજ્ઞેષ એન. સોહિ,
સ્ટેશન લેન્ડર બા.નં.૬૭૭/૬૮,
૨૫, ચીટી સેન્ટર કોમ્પ્લેક્સ,
હાથાણા, ભદ્રમતનર.
આ સ્ટેશનનો ઉપલોચ
છ માસમાં જ કરી ચકાસે



【註】

BVN-3/CT		
787	2	29
2012		

વેપારી ઇન્ડિયન કોલેસ બાવનગલ મધ્યે આજ સુરૂબ ૨૬/૦૩/૦૧૨ ના રોજ

એક પત્ર કૌભાવી લેનાર - ખરીદ કરનાર રજા ખાતે પ્રા.લી. વતી તેના અધિકૃત ડિરેક્ટર શ્રી પંકજકુમાર કૃપતરાય શાહ (૧.૩.૧૮), અવસાન: લેપાર સરનામું:- ધરમ પેટેલ, ચિત્રવંશ મોક, બોટ ને.ડી, ગિફ્ટાનગર, આલનગર (PIN NO.381001) જે પ્રથમ પાને હવે થઈ બા કેસમાં હસ્તાવેશમાં "ખરીદનાર" તરીકે સંબોધવામાં આવેલ છે અને પુર્વાધર સંદર્ભમાં જ્યાં અસંગત કે વિરુદ્ધ અર્થપૂર્વક ન હોય તેવા કાર્ય સ્થળે ખરીદનાર સમક્ષ અર્થમાં રજા ખાતે પ્રા.લી. ના તાલુકા તથા અખતો વખતુ જે સંબંધ હોય તે તમામ ડિરેક્ટરો તથા તેમના કાર્યોચરના વંશ-વારસો, એડમીનિસ્ટ્રેટર્સ, એસાઈનીબો અને એક્ઝિક્યુટર્સ વિવેરે તમામનો સમાવેશ થશે.

1. A. T. Smith, Superintendent, J. T. Smith, Jr., 1000




રાજ્ય ગુજરાત GUJARAT

730960

27 MAR 2012

નંબર Y65813
 તારીખ 28/3/2012
 સ્થાન સુરત
 કુલ રકમ રૂ. 25,000/- બીજા છે
 અગત્ય વર્ગ જાહેરનીય છે

જીજ્ઞેશ એન. શાહ,
 સોનપ વેનર લા.નં. 523/123,
 ૨૫, સીટી સેન્ટર કોમ્પ્લેક્સ,
 આશાપુરા, આમનગર,
 માં સ્ટેમ્પનો ઉપયોગ
 છ માસમાં જ કરી શકાયો.



(૩)

જોન બીજા પાસે આપો તબી આપનાર - વેચનાર આપનાર - શ્રી અણ્ણદબાર્ણ બોધાભાર્ણ સોલંકી
 ટી.પ.આ.ડેડ, અમરસાગર ખેતી, શર્મ હીન્દુ - સરનામું - ગામ - અમરસા, તા.પી. આમનગર (પિંડા
 No. 80) - જે બીજા પાસે તમે પાડી આ વેચનાર દસ્તાવેજમાં " વેચનાર " તરીકે સંબોધિયામાં
 આવેલ છે એને પુર્વાપર સંકર્ભમાં જાણે અભંગન કે વિદ્યુત્ત આઈ થતો ન હોય તેવા સર્વ સ્થળે વેચનાર
 સહના અર્થમાં તેઓનો તથા તેઓના ઘસ-ઘરનો, ઊભરાપીણરીઓ, બેઠાનીનીચેટસ, બેસાઈનીઓ
 અને બેઠાનીનીચેટસ રવેલેનો ઉપાવેલ થશે.

A. J. SHAM સહાયક દારૂ વેચનાર
 સોલંકી B. P. M.



રાત ગુજરાત GUJARAT

730961

27 MAR 2012

સંખ્યા ૮૮૫/૮
 નામ ડી.જી. રાજા શ્રી રા.
 ગોચારી ડી.જી. રાજા
 કલમ કિંમત રૂ. ૨૫,૦૦૦/- પરીકિત છે
 કલમ તરીકે જાહેર કરવાની

જીજ્ઞેશ એન. શાહ.
 સ્ટેમ્પ વેન્ડર શા.નં.૮૩/૮૩૩,
 ૨૫, સીટી સેન્ટર સોમલિય,
 શાંતિપાલ, ભાવનગર.
 આ સ્ટેમ્પનો ઉપયોગ
 છ માસમાં જ કરી શકાય.



(૪)

જોન ત્રીજા પરી અમો સંમતીઆપનાર - એ. મંદુ દેવલપર્શના પ્રોપરાઈટર શ્રી અણ્ણમેન જીલ-ભાઈ
 શાહ કુ.પ.પુત્ર, બ્યવસાય વેપાર કરનારુ - ૩૦૪, પંચકુલિય, કાળુબા રોડ, ભાવનગર (તા.ભ.વ.
 આણંદગામી) - જે ત્રીજા પાણે તમે પછી આ વેચાણ દસ્તાવેજમાં " સંમતીઆપનાર " તરીકે
 સંબોધિતમાંથીએ છે અને પુર્વપર સંબંધમાં જ્યાં અસંગત કે વિરુધ્ધ અર્થ થતો ન હોય તેવા સર્વ
 ભાગે સંમતી આપનાર સખના અર્થમાં તેમ્બોનો તથા તેમ્બોના વંશ-વરસો, ઉત્તરાધિકારીઓ,
 એડમીનીસ્ટ્રેટર, એસાઈનીઓ અને એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરો સમાવેશ થશે - બાકી અમો
 વેચનારસંમતીઆપનાર શીરે મુજબ હાની આપીએ છીએ.

SHAMBA PVT. LT.

A. J. SHAM. સુપરિન્ટેન્ડેન્ટ ડાયરેક્ટર
 ૨૭/૩/૧૨

Director



રાત ગુજરાત GUJARAT

730962

27 MAR 2012

સંખ્યા ૪૬૬૭/૧
તારીખ ૨૮/૩/૧૨
રોકવાસી ૨૫,૦૦૦/- બીડી ૭૩૦૯૬૨
અગામી દિવસે રૂ. ૨૫,૦૦૦/- બીડી ૭૩૦૯૬૨
અગામી ૨૬ માર્ચ ૨૦૧૨

BVN-3/CT
૨૪૬ ૫ ૨૭
2012

જીતેશ એન. શાહ.
સ્ટેમ્પ વેપારી જી.નં.૨૩/૯૩,
૨૫, મીડી સેન્ટર સેમ્પલિંગ,
કામરુપા, અમદાવાદ.
આ સ્ટેમ્પનો ઉપયોગ
છે માત્રમાં જ કરી શકાશે.



અમો વેપારીને જીલ્લા અને તાલુકા કચેરીઓમાં જોઈ ગયેલા અનવાજબ દેવનું સર્વે નં. ૨૫૬૬-૨ની કુલ ૫,૦૫૮ ચોરસ મીટર જમીનમાં સરેરાશના હેતુમાટે પાડવામાં આવેલ પ્લોટ નં. ૧ થી ૧૩ જેનું કુલ ક્ષેત્રફળ અનુક્રમે ૨૦૨.૩૩ ચો.મી., ૨૫૧.૫૨ ચો.મી., ૨૫૨.૭૮ ચો.મી., ૨૫૫.૮૬ ચો.મી., ૨૦૫.૭૩ ચો.મી., ૨૪૯.૫૯ ચો.મી., ૨૫૮.૭૬ ચો.મી., ૨૪૯.૦૦ ચો.મી., ૨૪૯.૦૦ ચો.મી., ૨૪૯.૦૦ ચો.મી., ૨૪૯.૦૦ ચો.મી., ૨૪૯.૦૦ ચો.મી., ૨૪૯.૦૦ ચો.મી. તથા ૨૮૫.૪૨ ચો.મી. કુલ ક્ષેત્રફળ ૨૩૦૭.૦૮ ચો.મી. છે તે મિલકત કે જેનું સંવિસ્તાર લખેલ આ દસ્તાવેજમાં મેલ જાવતા "પરિશિષ્ટ"માં આપવામાં આવેલ છે અને જેને હવે પછી આ વેચાણ દસ્તાવેજમાં "વેચાણકર્તાની મિલકત" તરીકે સંબોધવામાં આવેલ છે. સરસ્વ મિલકત અમો વેપારી પાસેથી તમો ખરીદનારે રૂ. ૨૦,૦૦,૦૦૦/- અને રૂપિયા ભરીતક સામ પુરતી વેચાણ કિંમતે વેચાણ રાખવા માગણી કરતા અમો વેપારી તમો ખરીદનારની સરસ્વ માગણી સ્વીકારતા આ વેચાણ દસ્તાવેજ અમો વેપારી તમો ખરીદનાર જોઈતી રીતે વિતરણ કરી આપીએ છીએ.

જી.જી.શાહ. સહાયક વેપારી
સહાયક વેપારી
જી.જી.શાહ. સહાયક વેપારી
સહાયક વેપારી



ગાંધી મુજરાત GUJARAT

730964

27 MAR 2012

રકમ રૂ. 25000/-
 નામ શ્રી. રામચંદ્ર રા. નં. 12345
 સેવામાંથી રૂ. 25000/- નો હિસ્સો
 આપણી કંપનીને આપવામાં આવેલ છે

શ્રી રામચંદ્ર રા. નં. 12345
 રા. નં. 12345 નો હિસ્સો
 આ સ્ટેમ્પનો ઉપયોગ
 છ માસમાં જ કરી શકાશે.

BVN-3/CT
 787 7 29
 2012



આમ આજે આ અરજી તા. 27/03/2012ના રોજ પોતાની ઉપરોક્ત જમીન અને વિત્ત કે વસીલતામાં
 ક્યાં સિવાય આવકમાં આપણે ઉપરોક્ત જમીન તેમજ સીધી જોડીના વારસો તરીકે તેમની સિવાય
 કોઈને પણ પુત્રીઓ રૂપરૂપે આપણને, આપણને, અનુભવે આપણને, કુટુંબને
 આપણને, અનુભવે આપણને તથા મીનાબેન આપણને વારસાઈ રૂઠીએ આપણને અને તે અને
 તકત પાસે આપણને નં. 12345 ના રોજ વારસાઈ નોંધ નં. 12345 કરવામાં આવેલ,
 સહરુ નોંધ નામના મુદતમાંથી (રેવ) આપણે તા. 27/03/2012ના રોજ પ્રમાણિત કરવામાં આવેલ, ગુ.
 આપણે અરજી તથા આપણે અરજીના વારસો અને ઉપરોક્ત જમીન અને વસીલતા કરવામાં આવેલ
 અને તે વસીલતા અનુસાર રેવનુ સર્વે નં. 12345, 12345, 12345 તથા 12345 જેનું
 સેવકામ અનુક્રમે બેકર 1 ગુણ 30, બેકર 1 ગુણ 10, બેકર 1 ગુણ 10, બેકર 0 ગુણ 10 તથા
 બેકર 5 ગુણ 10 ના માપ વાળી જમીન ગુ. આપણે અરજીના વારસો તથા આપણે, બીજા આપણે,

1. A. J. D. 2012/12345 નો હિસ્સો આપણે
 માટે છે
 P. J. D. 2012/12345
 DIRECTOR



ગુજરાત GUJARAT

730965

27 MAR 2012
 સંખ્યા: 27/3/12
 મુદત: 27/3/12
 મુદત: 27/3/12
 મુદત: 27/3/12
 મુદત: 27/3/12

BVN-3/CT
 187 8 29
 2012

જીસેશ એન. સાહે.
 કોમ્પ્યુટર ઓપરેટર,
 રાજ્ય સેન્ટર ફોર્મલેસ,
 કાચગામ, ભાવનગર,
 આ સ્ટેમ્પનો ઉપયોગ
 છ માસમાં જ કરી શકાય.



મીમા ભાઈ, સુરભા ભાઈ, મનુ ભાઈ, ભાગુ ભાઈ, તથા નાનુ ભાઈને પ્રાપ્ત કરેલ જમણે દેવનું સર્વે નં. ૨૧૦૬, ૨૧૦૭, ૫૧/૧૦૬, ૫૨૦૬, ૧૧૧૦૬, ૧૧૫/૧ ૦૬, ૧૨૦૬ તથા ૧૧૨૦૬ જેનું સંપૂર્ણ અર્થમાં એકર ૧ ગુણ ૧૦, એકર ૧ ગુણ ૩૮, એકર ૨ ગુણ ૧૬, એકર ૧ ગુણ ૧૦, એકર ૧ ગુણ ૦૦, એકર ૦ ગુણ ૨૩, એકર ૫ ગુણ ૧૫ તથા એકર ૦ ગુણ ૩૨ ના માપવાળી જમીન મુ. પ્રાંત અરજદારના વારસો પોલીસ, રૂપભાઈભેન ડાયાભાઈ, માનુભેન ડાયાભાઈ, કનુભેન ડાયાભાઈ, કુલીભેન ડાયાભાઈ, જનુભેન ડાયાભાઈ, તથા મીનાભેન ડાયાભાઈને પ્રાપ્ત કરેલ અને તે અંગે ૩૩૭ ૫૪૩ ચામી નમુના નં. ૬૫૫ તા. ૨૮/૮/૯૪ ના રોજ કરેલો નોંધ નં. ૯૮૪ કરવામાં આવેલ. શ્રી નાગભાઈ કાયાભાઈએ ઉપરોક્ત નોંધ મંજૂર થવા સર્વે મામલતદારશ્રી સમક્ષ તેમના હાજરી રજુ કરેલ પરંતુ તેના અંગે મામલતદારશ્રી, ભાવનગરે તેમના તા. ૫/૧૦/૧૯૯૫ તુકમથી ઉપરોક્ત કરેલો નોંધ મંજૂર કરેલ. આરજુ દેવનું સર્વે નં. ૧૫૨ રૂપભાઈભેન ડાયાભાઈ વિશેના નામમાં ગ્રામ નમુના નં. ૭૧૨ તથા ૮૫૮ કરવામાં આવેલ.

A. T. SHARMA, 27/3/12, 187 8 29, 2012, J. S. SHARMA, 27/3/12, 187 8 29, 2012




ગુજરાત GUJARAT

27 MAR 2012

730966

27 MAR 12

સંખ્યા ૧૬૬૦૬ તા. ૨૭/૩/૨૦૧૨ જ.સ.
 નામ ૧૬૬૦૬ તા. ૨૭/૩/૨૦૧૨ જ.સ.
 એવકાઈ ૧૬૬૦૬ તા. ૨૭/૩/૨૦૧૨ જ.સ.
 પ્રમાણ મિલન રૂ. ૨૫,૦૦૦- પરીક્ષકે ૧૬૬૦૬ તા. ૨૭/૩/૨૦૧૨ જ.સ.
 અવકાઈ જુદા-રીતે ૧૬૬૦૬ તા. ૨૭/૩/૨૦૧૨ જ.સ.



(૯)

જીતેશ એન. ચાલ.

સ્ટેમ્પ વેન્ડર આ.નં.૦૮૦/૦૩,
 ૧૫, સીટી સેન્ટર કોમ્પ્લેક્સ,
 શાંતિનગર, ભાવનગર.
 આ સ્ટેમ્પનો ઉપયોગ
 ૭ માસમાં જ કરી શકાશે.

શ્રી ધોળીબેન ડાહ્યાભાઈ તા. ૧૮/૦૨/૦૦ના રોજ ઉપરોક્ત જમીન માંહે પાલોલ્લા તેઓના હક્ક હિસ્સા અંગે વિજ કે વસીલનામુ ક્યાં વિધાય અવધાન પામતા જમીન માંહેનો તેઓનો હિસ્સો પાકીયા વારસોને વીળ થયેલ અને તે અંગે હક્ક પત્રક ગામ નમુના નં. ૬ મા તા. ૧૩/૧૨/૦૧ના રોજ વારસાઈ સીધ નં. ૨૦૮૧ કરવામાં આવેલ અને તારતુ નોંધ અમલદારશ્રી, ભાવનગર (ગ્રામ્ય) ખાસ તા. ૧૬/૦૩/૦૧ના રોજ પ્રમાણીત કરવામાં આવેલ. શ્રી રૂપજીભેન ડાહ્યાભાઈ વિનેરેએ તેઓની જમીન, બેક ઓફ ઈન્ડિયા, અગાડીયા સાખા, અલગાડા રોડ સહકારી મંડળી, ગુજરાત સ્ટેટ ઓ-એપ.કોર્પો. એન્ડ ફરમ ડેવ.એન્ડ સી, ભાવનગર શાખા જોગ થીલો મુકી વીરલ મેળવેલ અને તે અંગે ગામ નમુના નં. ૬/૧૨ માં એવો દાખલ કરવામાં આવેલ અને જે લોન શ્રી રૂપજીભેન ડાહ્યાભાઈ વિનેરે પાસા અરપાઈ કરી આપ્યા તથા ખોજા મુકિતના દાખલ ૧૪ કરતા તે અંગે હક્ક પત્રક ગામ નમુના નં. ૬ માં તા. ૧૩/૧૨/૦૧ના રોજ નોંધ નં. ૨૦૮૦ દાખલ કરવામાં આવેલ.

A. J. Shah

સાઈન્ટ ના D એવકાઈ નામ ૧૬૬૦૬ તા. ૨૭/૩/૨૦૧૨ જ.સ.



ગુજરાત GUJARAT

27 MAR 2012

730967

સંખ્યા: 787/10
 તારીખ: 27/3/12
 સોંપાણી: 25,000/- પચીસ હજાર રૂપિયા
 સ્થાન: ૭૮૭ નંબરની સીટ

શ્રી શેઠ એન. શાહ.
 સ્ટેમ્પ વેન્ડર ઓ.નં. ૯૩/૯૩,
 ૨૫, શ્રીમદેવેન્દ્ર પ્રેમભાઈ,
 કમ્પાઉન્ડ, બાવળવડ,
 આ સ્ટેમ્પનો ઉપયોગ
 હાથમાં જ કરી લેવાશે.

BVN-3/CT
 787 10 29
 2012



સહસ્ત્ર નોંધ માધ્યમસહસ્ત્ર, બાવળવડ (ગાંધી) ખાતે તા. ૨૬/૩/૨૦૧૧ ના રોજ પ્રમાણિત કરવામાં આવેલ છે. ત્યાર બાદ શ્રી રૂપભાઈવેન કાલાભાઈ વિવેરેએ ઉપરોક્ત રેન્જ સર્વે નં. ૪૫૬-૪ ની હે.આર.એ.પી. ૦-૫૦-૫૮ જમીનના વેચાણ અને શ્રી આર્જુનભાઈ ભોલાભાઈ ભોળેશી સાથે તા. ૧૮/૧૨/૨૦૧૦ ના રોજ વેચાણ કરાર કરેલ જે કરાર સમ રજીસ્ટ્રાર ક્વેટરી બાવળવડ-૩ ની ૧ નંબરની મુકામ અનુક્રમ નં. ૨૮૦૫ ની નોંધવામાં આવેલ. ત્યાર બાદ શ્રી રૂપભાઈવેન કાલાભાઈ વિવેરેએ તથા શ્રી આર્જુનભાઈ ભોલાભાઈ ભોળેશી વચ્ચે તા. ૩/૧૨/૨૦૧૦ ના રોજ ઉપરોક્ત સર્વે નં. ૪૫૬-૪ ની હે.આર.એ.પી. ૦-૫૦-૫૮ જમીન સર્વે નં. ૨૮૦૫ ની રજીસ્ટ્રાર ક્વેટરી બાવળવડ-૩ ની ૧ નંબરની મુકામ અનુક્રમ નં. ૨૮૦૫ ની નોંધવામાં આવેલ.

A. T. SHAM. સુપ્રાઇન્ડેન્ડેન્ટ ઓફ રજીસ્ટ્રાર
 ૨૦/૩/૧૨
 HAZA PVT. LTD.
 DIRECTOR



રાત ગુજરાત GUJARAT

27 MAR 2012

E 552890

જાણીતી વ્યક્તિની સાથે
જાણીતી વ્યક્તિની સાથે
જાણીતી વ્યક્તિની સાથે
જાણીતી વ્યક્તિની સાથે
જાણીતી વ્યક્તિની સાથે
જાણીતી વ્યક્તિની સાથે

જીવેશ એન. શાહ
સ્ટેપ વેન્ડર ટા.નં. ૬૩/૬૩,
૨૫, સીટી સેન્ટ્રલ ફોર્મર,
કાલાનગા, ભાવનગર.
આ સ્ટેપવેન્ડર ઉપરથી
૭ માર્ચમાં જ કરી શકાય


BVN-3/CT		
7-87	13	29
2012		

(13)

મેળવણી કરી આપેલ અને આવનગર વિસ્તાર વિસ્તાર સત્તા મંજૂરી તેથી તા.૧૫/૧૨/૨૦૧૦ની
પરવાનગી નં.બીએસીએલ/૧૦૫૨૦૦૮/મેલ.આર/૧૦૦૩/૧૦૦૩-૨૦૧૦ અન્વયે ૧ થી ૧૩
પોલ્ટરનો કોમ્પાઉન્ડ સામેનો રાખ પોલ્ટરનો જે-આઉટ ખાત મંજૂર કરી આપેલ.

મંજૂર પોલ્ટરનો-આઉટ ખાત-માં દર્શાવવામાં આવેલ રોકાણના તમામ પોલ્ટ નં. ૧ થી ૧૩ જેનું લેણકા
જનુઆરી ૨૦૧૨ થી. ૨૫૧.૫૨ થો.મી., ૨૫૨.૭૮ થો.મી., ૨૫૫.૮૬ થો.મી., ૨૬૫.૬૩
થો.મી., ૨૬૮.૬૬ થો.મી., ૨૫૮.૭૬ થો.મી., ૨૬૮.૦૦ થો.મી., ૨૬૮.૦૦ થો.મી., ૨૬૮.૦૦
થો.મી., ૨૬૮.૦૦ થો.મી., ૨૬૮.૦૦ થો.મી. તથા ૨૦૫.૪૨ થો.મી. કુલ લેણકા ૩૩૦૦.૦૮
થો.મી. જેમીન આપો વેચાણ વેચાણ આપવા અને સંબંધિત આપણને તે વેચાણ રાખવા જનુઆરી ૨૦૧૨
આપણી વચ્ચે તા.૧૦/૦૩/૨૦૧૨ ના રોજ વેચાણનો કરાર કરવામાં આવેલ. સહસ્ત્ર કરાર અન્વયે

૧. જી.જી. શાહ- સહસ્ત્ર કરાર (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) (૮) (૯) (૧૦) (૧૧) (૧૨) (૧૩)
સહસ્ત્ર કરાર (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) (૮) (૯) (૧૦) (૧૧) (૧૨) (૧૩)



અમો સંમતિઆપનારને પ્રાપ્ત થયેલ વેચાણના હકકો અમો સંમતિઆપનાર સહરતુ પ્લોટ નં. ૧ થી ૧.૩ વાળી ખૂણી જમીન ખરીદવાના અમારા હકકો તમો ખરીદનાર રૂ.૧૦,૦૦,૦૦૦/- ની વેચાણ કીમતે હુન્નર કરી આપવા ઉચિત અને તમો ખરીદનાર તે રીતે રાખવા કબુલ કરતા આ વેચાણ હસ્તાંતર તમો ખરીદનાર જોગ કરી આપીએ છીએ. તે તે વિગતે વેચાણવાળી જમીન અમો વેચનારના તરફ, કબજા, બોગસદામાં છે અને તેના ચર્ચિત સંપૂર્ણ ચોખ્ખા વેચાણ હકક સાથે વેચાણવાળી મિલકત તમો ખરીદનારને વેચાણ આપી તેમજ કાંત, ખાલી, કાચા અને નિર્મિત કબજો આજરોજ સોંપી આપેલ છે.

૪) સહરતુ વેચાણવાળી મિલકત અમો વેચનારની ઉપરની વિગતે ચોખ્ખા વેચાણ હકક વાળી અને તમામ બોજા રહીત છે. જેમાં કોઈ ભવિત કે સંસ્થાનુ કોઈપણ પ્રકારનુ હકક-ચીત, ટર-દારો, બોજો રહેલો છે નહીં, સહરતુ મિલકત સર્વોર્થ કોઈ વિવાદ કોઈ કચેરીમાં ચાલતા નથી. તેમજ અમો વેચનાર સામે મનાઈ હુકમ કે એકવીડેન્સની કોઈ નોટીસ આજ સુધી જારી કરવામાં આવેલ નથી, કે તેના પ્રકારની કોઈ નોટીસ અમો વેચનારને મળેલ નથી. આ મિલકત સર્વોર્થ કોઈપણ પ્રકારના કોઈ વિવાદ ચાલતા નથી કે કોઈ સરનામો કે અન્ય કોઈ સરકારી કે અર્ધસરકારી કચેરીમાં પણ આ મિલકત સર્વોર્થ કોઈ વિવાદ પેડીંગ નથી. વેચાણવાળી મિલકત એકવીડેન્સ કે રેકોર્ડીંગમાં નથી કે આ મિલકત જમીન અને ઉત્કર્ષક વારાન્ત કોઈ કોલોનીયલ ચાલતા નથી તેમ અમો વેચનાર આપી જાહેર કરીએ છીએ. અમો વેચનાર આ મિલકત સર્વોર્થ કબજે અન્ય કોઈની સામે કોઈ કરાર કે તખલ્લુક કરેલ નથી. અમો વેચનારના સહરતુ બરોડા અને ખાલીના આધારે તમો ખરીદનારે સહરતુ મિલકત વેચાણ રાખેલ છે. તેમ જતા ભવિષ્યમાં આવુ કઈ નીકળી આવે કે મનાવ તો તે તે સમયે અમો વેચનારે અમારા અર્થે ચોખ્ખુ કરી કચાલી આપવાનુ છે. આ અર્થે તમો ખરીદનારને કઈ નુકસાન જાણ તો તેની નુકસાનીની રકમ તમો ખરીદનાર અમો વેચનાર પાસેથી વ્યાજ, ખર્ચ સહીત વસુલ કરવા હકકદાર છી.

૫) અમો વેચનાર તુલ્યમાં આલેખી આપીએ છીએ કે, મજકુર વેચાણવાળી મિલકતના તમો ખરીદનાર તમામ અવલોકનના વંશ, વારસો વિગેરે તમામના પાસીસ, કબજા, બોગસદા અને ઉપયોગ કરવાના હકકમાં અમો વેચનાર તમામ અવલોકનના વંશ-વારસો, વિગેરે કરતા - અંતરાય કે અટકાવતા રહીશું - કરાવીશું નહીં તેમ જતા કરીએ આ આવીએ અને તેના સરણે તમો ખરીદનારને કે તમારા વંશ, વારસો વિગેરે તમામને થતુ હરેક પ્રકારનુ નુકસાન કે ખર્ચ થાય તો તે તમામ અવેજ સહીતની પુરુષી ભાષણ અમો વેચનાર તમામ અમારા વંશ, વારસો વિગેરે બંધાયેલ છીએ.

A. F. SHAH. રાણી દેવી ડાહ્યાદાસી
 રોડ નં. ૧૬૬
 PLAZA PVT. LTD.
 DIRECTOR

(14)

BYN-3/CT		
787	15	29
2012		

૧) વેપારશાળી પ્રિન્ટની વેચાણના અવેજની રકમ રૂ. ૪૦,૦૦,૦૦૦/- અને રૂપીયા ચાલીસ લાખ પુરા થીયેની રિગતે તમારો ખરીદનારે અમો વેચનારને વસુલ આપેલ છે.

રૂ. ૧૩,૦૦,૦૦૦/-

અંકે રૂપીયા તેર લાખ પુરા, પુણે બેઠ, દરબારવાડ સાખા, આવનગરના કોસ એકાઉન્ટ પેઈ ચેક નં. ૭૭૬૪૦૧ તા. ૧૦/૦૧/૨૦૧૨ થી.

રૂ. ૭,૦૦,૦૦૦/-

અંકે રૂપીયા સાત લાખ પુરા, પુણે બેઠ, દરબારવાડ સાખા, આવનગરના કોસ એકાઉન્ટ પેઈ ચેક નં. ૭૭૬૪૦૩ તા. ૦૧/૦૨/૨૦૧૨ થી.

રૂ. ૧૦,૦૦,૦૦૦/-

અંકે રૂપીયા દસ લાખ પુરા, પુણે બેઠ, દરબારવાડ સાખા, આવનગરના કોસ એકાઉન્ટ પેઈ ચેક નં. ૭૭૬૪૦૪ તા. ૨૭/૦૩/૨૦૧૨ થી.

રૂ. ૫,૭૨,૦૦૦/-

અંકે રૂપીયા પાંચ લાખ બોતેર હજાર પુરા, પુણે બેઠ, દરબારવાડ સાખા, આવનગરના કોસ એકાઉન્ટ પેઈ ચેક નં. ૭૭૬૪૦૬ તા. ૨૬/૦૩/૨૦૧૨ થી.

રૂ. ૪,૨૮,૦૦૦/-

અંકે રૂપીયા ચાર લાખ બીસીસ હજાર પુરા, પુણે બેઠ, દરબારવાડ સાખા, આવનગરના કોસ એકાઉન્ટ પેઈ ચેક નં. ૭૭૬૪૦૭ તા. ૨૬/૦૩/૨૦૧૨ થી.

રૂ. ૪૦,૦૦,૦૦૦/-

અંકે રૂપીયા ચાલીસ લાખ પુરા.

તે રીતે વેચાણના અવેજની રકમ મુકતે અમો વેચનાર/સંમતીઆપનારને વસુલ માળી ચલેલ છે અને હવે કાઈ રકમ આઠી રહેતી નથી તેમ અમો વેચનાર આવી કમુલ કરીએ છીએ અને વેચાણના અવેજની સઘળી જવાબદારીઓથી તમારો ખરીદનારને મુકત કરીએ છીએ.

A. J. SHAH

2-13-12 માં ૦૦૦૦ હાક્માં

BYN PLAZA PVT. LTD.
સચીવ
DIRECTOR

(૧૬)

BVN-3/CT	
૩૪૬	૧૬/૨૭
2012	

૭) વેચાણવાળી મિલકતના વેચાણના અવેજની રકમ અમો વેચનારને તમો ખરીદનારે ઉપર જણાવેલ રિંગને વસુલ આપેલ હોય અને વેચનારે તમો ખરીદનારને વેચાણવાળી મિલકતનો સાંમ ખાલી અને પ્રત્યક્ષ કબજો આજ રોજ સોંપી આપેલ છે. જેથી સ્પષ્ટ મિલકતના તમો ખરીદનાર કુલ અને સ્પર્ધાત્મક માલિક બનેલ છે. જે અન્યથા તમો ખરીદનાર વેચાણવાળી મિલકતનો વાકો તે રીતે ઉપબોધ, બોધવર્તી, વેચાણ, ખીસે, બકિલ, દુન્યાકર અને બેસાર્ટન કરવા હક્કકાર છે. સ્પષ્ટ વેચાણવાળી મિલકતના જે કાંઈ હક્કો હોય તે અને તેમા મળતા તમામ હક્કો સાથેના હક્કો હોય આ દસ્તાવેજની તમો ખરીદનારને દુન્યાકર કરી આપીએ છીએ. જ્યારે અમો વેચનારના અથવા તમામ પ્રકારના સ્પષ્ટ મિલકત પરતભેદ હક્કો આ વેચાણ દસ્તાવેજની તારીખથી પહે પડે છે તેમ આવી જાહેર કરી કમુખીએ છીએ.

૮) વેચાણવાળી મિલકતના અમો વેચનારના વેચાણ હક્ક કાર્યાલય આધાર પુરાવાઓ/ દસ્તાવેજો આ સાથે નીચે મુજબ સોંપી આપેલ છે.

- ૧) અકવાજના રેવન્યુ સર્વે નં. ૪ પેટીની બેઠક ૧ મુકા ૧૦ જમીન ક્ષી ૧૦૫ આપા તથા અરજણ બાવાના નામે દાખલ કર્યા બંને હક્ક પત્રક ગ્રામ નમુના નં. ૬ કરવામાં આવેલ નોંધ નં. ૧૭ ની પ્રમાણીત નકલ.
- ૨) ક્ષી બાવા અરજણ ના. ૬/૮/૬૪ ના રોજ જમીન માં પડેલ ત્રણેય ત્રીસક બંને વિષ કે વસીયતનામુ કર્યા વિષય અવસાન પામતા તેમના સોળી બીટીના ચરસો નામા, બીમા, ખીમા, મુસા, મહુબેન, આહુબેન, તથા નાનુ આપાને ચારસાઈ રૂઈએ પ્રાપ્ત પડેલ અને તે બંને હક્ક પત્રક ગ્રામ નમુના નં. ૬ મા તારીખ ૧૬/૬૪ ના રોજ ચારસાઈ નોંધ નં. ૩૨૮ ની પ્રમાણીત નકલ.
- ૩) ક્ષી બાવા અરજણ તા. ૨૫/૦૬/૮૩ ના રોજ જમીન બંને વિષ કે વસીયતનામુ કર્યા વિષય અવસાન પામતા જમીન તેમના સોળી બીટીના ચરસો તરીકે તેમની વિધવા બેંગીબેન તથા પુત્રીઓ રૂપચાઈબેન, માનુબેન, કમુબેન, ફુલીબેન, અનુબેન, તથા પીનાબેનને ચારસાઈ રૂઈએ પ્રાપ્ત પડેલ અને તે બંને હક્ક પત્રક ગ્રામ નમુના નં. ૬ મા તા. ૧૧/૦૮/૮૪ ના રોજ ચારસાઈ નોંધ નં. ૭૬૧ ની પ્રમાણીત નકલ.
- ૪) મુ. બાવા અરજણ તથા બાવા અરજણના ચરસો બંને રેવન્યુ સર્વે નં. ૪૫૧કી, ૫૧/૧, ૫૨૧કી, ૧૧૦/૧, ૧૨૩૧કી, ૪૫૧કી, ૫૨૧કી, ૧૧૧૧કી, ૧૧૫/૧ ૧કી તથા ૧૧૨૧કી ની

મી. જ. ગાંધી. સુસાઈના ઓફીસ નાં ૦૮/૦૮/૧૨
સોલિડિટી
J. J. Gandhi
DIRECTOR

જમીનની કદીલ અંગે તકત પત્રક ગમ નમુના નં. ૬ માં તા. ૨૮/૮/૯૪ ના રોજ કરવામાં આવેલ નોંધ નં. ૯૮૪ ની પ્રમાણિત નકલ.

- ૫) શ્રી નાથાભાઈ આણાભાઈ ઈપસોકલ નોંધ નં. ૯૮૪ તથા શ્રી મામલતદારશ્રી સમક્ષ રજુ કરેલ તેઓના ચાંદાઓ અંગે મામલતદારશ્રી, આવનગર તા. ૫/૧૦/૧૯૯૫ ના રોજ કરેલ હુકમની પ્રેરણ નકલ.
- ૬) શ્રી ધોળીબેન ડાવાભાઈ તા. ૧૮/૭/૨૦૦૬ ના રોજ જમીન અંગે પાડોષતા તેઓના હક્ક વિસ્તાર અંગે વિલા કે વસીલનવામુ ક્યાં વિલાપ અવસાન પામ્યા જમીન માંલેનો તેઓનો લીસો બાકીના વારસોને પ્રાપ્ત થયેલ અને તે અંગે હક્ક પત્રક ગમ નમુના નં. ૬ માં તા. ૧૩/૧૨/૨૦૧૦ ના રોજ પારજાર્ડ નોંધ નં. ૨૦૮૧ ની પ્રમાણિત નકલ.
- ૭) શ્રી રૂપભાઈબેન ડાવાભાઈ વિગેરેએ તેઓની જમીન, યેંક એક ઈન્ડીયા, અઘાલીયા સાખા, અઘાલા સેવા સહકારી મંડળી, ગુજરાત સ્ટેટ ઈ-મોબ-એગ્રી, એન્ડ રૂરલ ડેવલપ્મેન્ટ લી, આવનગર કાળામાં તારણમાં પુરી વિલાસ મેળવેલ અને તે લોન બદલાઈ થયેલી તથા વિલાસ મુક્તિના કાળમાં રજુ કરતા હક્ક પત્રક ગમ નમુના નં. ૬ માં તા. ૧૩/૧૨/૨૦૧૦ ના રોજ નોંધ નં. ૨૦૮૦ ની પ્રમાણિત નકલ.
- ૮) અમો વેરવાર તથા રૂપભાઈબેન ડાવાભાઈ વિગેરે વચ્ચે સર્વે નં. ૪૫૬-૪ ની રે. અરે. ચો. શ્રી. ૦-૫૦-૫૯ જમીન સર્વે તા. ૧૮/૧૨/૨૦૦૯ ના રોજ કરવામાં આવેલ રજીસ્ટર્ડ વેચાણ કરાર અનુક્રમ નં. ૨૯૦૫ (અસલ)
- ૯) અમો વેરવાર તથા રૂપભાઈબેન ડાવાભાઈ વિગેરે વચ્ચે સર્વે નં. ૪૫૬-૪ ની રે. અરે. ચો. શ્રી. ૦-૫૦-૫૯ જમીન સર્વે તા. ૬/૧૨/૨૦૧૦ ના રોજ કરવામાં આવેલ રજીસ્ટર્ડ વેચાણ કરાર (કળા સહિતનો) અનુક્રમ નં. ૫૦૫૧ (અસલ)
- ૧૦) રૂપુરી કલેક્ટરશ્રી, આવનગર-એ હુકમની જમીનના વેચાણ અંગેની પરવાનગી આપણે તા. ૧૩/૧૨/૨૦૧૦ ને હુકમ નં. જમીન/વહીવટ/૧૧ તથા તે અંગે હક્ક પત્રક ગમ નમુના નં. ૬ માં તા. ૦૪/૦૪/૨૦૧૧ ના રોજ કરવામાં આવેલ નોંધ નં. ૨૦૬૦ ની પ્રમાણિત નકલ.
- ૧૧) અમો વેરવાર આર્જંદભાઈ બેવાભાઈ મોલંડી જોડે શ્રી રૂપભાઈબેન ડાવાભાઈ, મનુબેન ડાવાભાઈ, હનુબેન ડાવાભાઈ, અંજુબેન ડાવાભાઈ, ફૂલીબેન ડાવાભાઈ તથા ધીરજબેન ડાવાભાઈ રાી તેના હુલમુખવાર શ્રી અમીત મીપીનવંદુ સાથે થયેલી આગેલ રજીસ્ટર્ડ વેચાણ કરારવેલ અનુક્રમ નં. ૧૮૦ તા. ૧૦/૦૧/૨૦૧૧ (અસલ)

A. J. SHAM. સહાયક નાડી બેંકના નાડી ડાયરેક્ટર
 ૨૦/૧૧/૧૨
 DIRECTOR

- ૧૩) સદરતુ ડિપાર્ટમેન્ટ વેચાણ એવેની ૨૩૩૩ પાસે ગામ નમુના નં. ૨ મા તા. ૦૪/૦૨/૨૦૧૧ના રોજ કરવામાં આવેલ નોંધ નં. ૨૦૯૧, જે નોંધ મામલતદારશ્રી, આવનગર તા. ૦૫/૦૫/૨૦૧૧ના રોજ પ્રમાણિત કરેલ.
- ૧૪) અમો વેચનાર આર્જંદખાઈ બોચાખાઈ સોલંકીના નામમાં રેવન્યુ કવેરી ક્વાટર કાળકવામાં આવેલ ગામ નમુના નં. ૮/બ તથા ૭/૧૨ ની પ્રમાણિત નકલ.
- ૧૫) કવેરીશ્રી આવનગર તા. ૧૪/૧૦/૨૦૧૧ના બીન ખેતી બોર્ડ નં. જમીન -૩-બીએકેસ ૨૪૧ નં. ૮/૭૦૧૧-૧૨ (અસલ)
- ૧૬) સર્વે નં. ૪૧૬-૪ ની પટપાટ મો.બી. બીન ખેડવાળા જમીનમાં સેર પ્લોટ નં. ૧ થી ૧૩ તથા કોમન પ્લોટ સેપરેટ મજમુ ૨૨૨નો દર્શાવતો મંજૂર ચર્ચેલ લે-આઉટ પ્લાન નકલ.
- ૧૭) અમો વેચનાર આર્જંદખાઈ બોચાખાઈ સોલંકી તથા બી આસામેલ જીવનપાઈ સાલ વચ્ચે પ્લોટ નં. ૧ થી ૧૩ ની જમીન સર્વે તા. ૧૦/૦૨/૨૦૧૨ના રોજ કરવામાં આવેલ વેચાણ કરાર (અસલ).
- ૧૮) અમો વેચનાર આર્જંદખાઈ બોચાખાઈ સોલંકીના નામના ગામ નમુના નં. ૮/બ તથા ૨ ના પ્લાન નં. ૮૫૧ નો પ્રમાણિત ડેવારો

આ વિષય અમો વેચનાર પાસે બીજા કોઈ દસ્તાવેજો નથી તેમ આથી જાહેર કદીએ છીએ અને અન્ય કોઈ દસ્તાવેજો મળી આવશે તો તે તમો ખરીદનારને સુપ્રત કરી આપીશું.

૯) વેચાણમાંથી મિલકત તમો ખરીદનારના નામે રેવન્યુ દફતરે, ગામ પંચાયત, પી.જી.વી.સી.એલ.માં કે અન્ય સરકારી કે અર્ધ સરકારી કવેરીમાં તમો ખરીદનાર તમારા અર્થે મદાવવા તકાલ્લુ છો. જે બંને જરૂરી સાર સંવચાર અમો વેચનારે આપવાનો છે જરૂર પડશે તુલુ આવી સહીઓ સોર્ગિસમાવ્યો કરી આપવાના રહેશે. આ વિલનના વેચાણ દસ્તાવેજ સર્વે કોઈ સુધારા દસ્તાવેજ કરી આપવાની જરૂરીયાત ઉપસ્થિત થાય તો તે અમો વેચનારે કરી આપવાના છે. તેમજ આ મિલકત તમો ખરીદનારના નામે દરેક જરૂરી રેકર્ડમાં ટૂંકાકર કરવામાં અમો વેચનારે સંપૂર્ણ સાલ અને સહકાર આપવાનો છે.

૧૦) સદરતુ મિલકત સમીના કવેરીશ્રી જવાબદારી વેચાણ દસ્તાવેજની તારીખ સુધીની અમો વેચનારની રહેશે ત્યારબાદ તમો ખરીદનારની હડ થશે. તેમજ અવિષમાં તેડુ કોઈ સેવુ થાકી નીકળે તો તે તમામ અમો વેચનારે ભરવાનું છે આ બંને તમો ખરીદનારની જવાબદારી વેચાણ દસ્તાવેજની તારીખ પછીથી થડુ થશે.

A. J. Dhan. 25/10/2012
PLAZA PVT. LTD.
 Director

BVN-3/CT		
784	19	29
2012		

(10)

૧૧) વેચાણવાળી મિલકતના વેચાણના અવેજની રકમ રૂ.૧૦,૦૦,૦૦૦/- અને રૂપીયા સહીત સાબ પુરાણી હાંપ આ વેચાણ દરમિયાન સરકારે નિયત કરેલ જેથી અનુસાર રૂ.૨,૫૦,૦૦૦/- અને રૂપીયા બે સાબ સત્તાવાન હકાર પુરા ના નોન-જમીનીશીલ્પ સ્ટેમ્પ પેપર ઉપર કરવામાં આવેલ છે.

૧૨) આ વેચાણ દરમિયાનનો તમામ પ્રકારનો ખર્ચ જેવો કે સ્ટેમ્પ ટાપુટી, નોંધણી ફી, લાન્ડર્ડ ફી, વગેરે ખરીદનારે બેરખર્ચાની છે.

આ જમીન સાથે આવેલ છે આઉટ પ્લાન બુજાનની વચ્ચે આવતી રસ્તા, ગેલ્વર્ડ તથા કોમન પ્લોટ નંબરેની સાર્વજનિક જમીન દરેક પ્લોટ ચારકોના ઉપયોગ માટેની રહેશે. વચ્ચે આવતી કોમન જમીન અને રસ્તાઓનો ઉપયોગ કરવા, ધાતુકા, પાલકા, ચાલન તારવા અર્ધ જવાના ઉપયોગ સાથે ની જમીન મણાસી, લેમજ કરતો આવકથી કોમન પ્લોટ તથા અંતરિક્ષ માજમુ રસ્તાની જમીનનો ઓસ્મેની પ્લાટ બરવાની જવાબદારી હવેથી તમને ખરીદનારની રહેશે.

" ૫ મિ મિ ૫ "

== વેચાણવાળી મીલકતનું વર્ણન ==

જીલ્લા અને તાલુકા સત્તાવારના મોજે સામ સત્તાવારના રેકર્ડ નં. ૪૦૬-૪ની કુલ ૫,૦૫૯ ચોરસ મીટર જમીનમાં સરેરાશના નેતુઆરે પાસમાં આવેલ પ્લોટ નં. ૧ થી ૧૩ જેનું લેખક અનુક્રમે ૨૯૮.૭૩ ચો.મી., ૨૫૧.૫૨ ચો.મી., ૨૫૮.૭૮ ચો.મી., ૨૫૫.૮૬ ચો.મી., ૨૦૫.૭૩ ચો.મી., ૨૪૮.૬૯ ચો.મી., ૨૫૮.૭૬ ચો.મી., ૨૭૮.૦૦ ચો.મી., ૨૪૮.૦૦ ચો.મી., ૨૪૮.૦૦ ચો.મી., ૨૪૮.૦૦ ચો.મી., ૨૪૮.૦૦ ચો.મી. તથા ૨૯૫.૪૨ ચો.મી મળી કુલ લેખક ૩૩૭૭.૦૯ ચો.મી. છે તે પ્લોટ નં. ૧ થી ૧૩ જેની ચતુ:કોણ નીચે મુજબ છે.

પ્લોટ નં. ૧ લેખક ૨૯૮.૭૩ ચો.મી.

ઉત્તર : આ તરફ ૭.૫૦ મીટર પહોળો રસ્તો આવેલ છે.

દક્ષિણ : આ તરફ હાલુ સર્વે નં. ૧૫ થાળી જમીન આવેલ છે.

પૂર્વ : આ તરફ ડી.પી. રોડ અને ત્યારબાદ હાલનું રોડ આવેલ છે.


પશ્ચિમ : આ તરફ પ્લોટ નં. ૨ આવેલ છે.

મિ. F. S. M. 25/10/2012

VEDA PLAZA PVT. LTD.

Signature B. M. M. DIRECTOR

(૨૦)



પ્લોટ નં. ૨ સેક્ટર ૨૫૧, ૧૨, બો.બી.

- કિલર : આ તરફ ૭.૫૦ મીટર પહોળો રસ્તો આવેલ છે.
દક્ષિણ : આ તરફ ભાડુ સર્વે નં. ૧૫ ચાલી જમીન આવેલ છે.
પૂર્વ : આ તરફ પ્લોટ નં. ૧ આવેલ છે.
પશ્ચિમ : આ તરફ પ્લોટ નં. ૩ આવેલ છે.

પ્લોટ નં. ૩ સેક્ટર ૨૫૨, ૧૮, બો.બી.

- કિલર : આ તરફ ૭.૫૦ મીટર પહોળો રસ્તો આવેલ છે.
દક્ષિણ : આ તરફ ભાડુ સર્વે નં. ૧૫ ચાલી જમીન આવેલ છે.
પૂર્વ : આ તરફ પ્લોટ નં. ૨ આવેલ છે.
પશ્ચિમ : આ તરફ પ્લોટ નં. ૪ આવેલ છે.

પ્લોટ નં. ૪ સેક્ટર ૨૫૩, ૮૬, બો.બી.

- કિલર : આ તરફ ૭.૫૦ મીટર પહોળો રસ્તો આવેલ છે.
દક્ષિણ : આ તરફ ભાડુ સર્વે નં. ૧૫ ચાલી જમીન આવેલ છે.
પૂર્વ : આ તરફ પ્લોટ નં. ૩ આવેલ છે.
પશ્ચિમ : આ તરફ પ્લોટ નં. ૫ આવેલ છે.

પ્લોટ નં. ૫ સેક્ટર ૨૭૫, ૭૩, બો.બી.

- કિલર : આ તરફ ૭.૫૦ મીટર પહોળો રસ્તો આવેલ છે.
દક્ષિણ : આ તરફ ભાડુ સર્વે નં. ૧૫ ચાલી જમીન આવેલ છે.
પૂર્વ : આ તરફ પ્લોટ નં. ૪ આવેલ છે.
પશ્ચિમ : આ તરફ પ્લોટ નં. ૬ આવેલ છે.

A.T. SHAH & SONS

SHAH & SONS PVT. LTD.
J. B. SHAH
DIRECTOR

BVN-3/CT		
367	2119	
2012		

વિભાગ : આ તરફ ૬,૦૦ મીટર રસ્તો આવેલ છે.
 દક્ષિણ : આ તરફ વાઘુ સર્વે નં. ૧૫ તથા ૪ વાળી જમીન આવેલ છે.
 પૂર્વ : આ તરફ પહોર નં. ૪ આવેલ છે.
 પશ્ચિમ : આ તરફ વાઘુ સર્વે નં. ૪ વાળી જમીન આવેલ છે.

પ્રિયતમ : આ તરફ જાનુ. સર્વે નં. ૪ પેઠી-૪ ની બાકીની જમીન આવેલ છે.
 સિલિંગ : આ તરફ ઇ.પીટર પ્લાયોથો રસ્તો તથા કોમન પ્લોટ આવેલ છે.
 મુર્બ : આ તરફ પ્લોટ નં. ૮ આવેલ છે.
 પશ્ચિમ : આ તરફ કોમન પ્લોટ તથા બોર્ડર આવેલ છે.

ઉત્તર : આ તરફ આગુ સર્વે નં. ૪૫૬(ી)-૪ ની બાકીની જમીન આવેલ છે.
 દક્ષિણ : આ તરફ ૭.૫૦ મીટર પહોળો રસ્તો તથા હોમન પ્લોટ આવેલ છે.
 પૂર્વ : આ તરફ પ્લોટ નં. ૮ આવેલ છે.
 પશ્ચિમ : આ તરફ પ્લોટ નં. ૭ આવેલ છે.

ઈતાર : આ તરફ આગુ તરે નં. ૬ પેડી-૬ ની બાકીની જમીન આગેશ છે.
 દક્ષિણ : આ તરફ ડ. ૫૦ મીટર પહોળો રસ્તો તથા હોમન પાંદે આગેશ છે.
 પૂર્વ : આ તરફ પાંદે નં. ૧૦ આગેશ છે.
 પશ્ચિમ : આ તરફ પાંદે નં. ૮ આગેશ છે.

A. T. SHARMA 20/11/2017
DIRECTOR

(૨૨)

BVN-3/CT		
૪૮૭	૨૨	૨૭
2012		

પ્લોટ નં. ૧૦ સેક્ટર ૨૪૯.૦૦ ચો.મી.

- ઠીકાર : આ તરફ થાનુ સર્વે નં. ૪૫૬-૪ ની બાકીની જમીન આવેલ છે.
દિશા : આ તરફ ૭.૫૦ મીટર પહોળો રસ્તો તથા કોમન પ્લોટ આવેલ છે.
પૂર્વ : આ તરફ પ્લોટ નં. ૧૧ આવેલ છે.
પશ્ચિમ : આ તરફ પ્લોટ નં. ૯ આવેલ છે.



પ્લોટ નં. ૧૧ સેક્ટર ૨૪૯.૦૦ ચો.મી.

- ઠીકાર : આ તરફ થાનુ સર્વે નં. ૪૫૬-૪ ની બાકીની જમીન આવેલ છે.
દિશા : આ તરફ ૭.૫૦ મીટર પહોળો રસ્તો તથા કોમન પ્લોટ આવેલ છે.
પૂર્વ : આ તરફ પ્લોટ નં. ૧૨ આવેલ છે.
પશ્ચિમ : આ તરફ પ્લોટ નં. ૧૦ આવેલ છે.

પ્લોટ નં. ૧૨ સેક્ટર ૨૪૯.૦૦ ચો.મી.

- ઠીકાર : આ તરફ થાનુ સર્વે નં. ૪૫૬-૪ ની બાકીની જમીન આવેલ છે.
દિશા : આ તરફ ૭.૫૦ મીટર પહોળો રસ્તો તથા કોમન પ્લોટ આવેલ છે.
પૂર્વ : આ તરફ પ્લોટ નં. ૧૩ આવેલ છે.
પશ્ચિમ : આ તરફ પ્લોટ નં. ૧૧ આવેલ છે.

પ્લોટ નં. ૧૩ સેક્ટર ૨૪૯.૦૦ ચો.મી.

- ઠીકાર : આ તરફ થાનુ સર્વે નં. ૪૫૬-૪ ની બાકીની જમીન આવેલ છે.
દિશા : આ તરફ ૭.૫૦ મીટર પહોળો રસ્તો તથા કોમન પ્લોટ આવેલ છે.
પૂર્વ : આ તરફ ડી.બી. રોડ અને ન્યારમાડ તથા રોડ આવેલ છે.
પશ્ચિમ : આ તરફ પ્લોટ નં. ૧૨ આવેલ છે.

A. J. SHAM. 24/11/2012
PLAZA PVT. LTD.
DIRECTOR

(૨૦)

BVN-3/CT		
787	23	29
2012		



મિલકતનું પોસ્ટલ સરનામું:-

જીલ્લા અને તાલુકા ભાગલાવના મોજે ગામ અંતર્યાલના
વેગન્યુ સર્વે નં. ૩૫૬૬-૨ની કુલ ૫,૭૫૮ ચોરસ મીટર
જમીનમાં રોમાંકિત નેતુમકા પાકવામાં આવેલ પ્લોટ નં. ૧
થી ૧૩

વિકાસ સંસ્થાનારની સહી

DIJ PLAZA PVT. LTD.
Jankh...
DIRECTOR

મિલકત તુલકીય કરનારની સહી

...
A. J. ...

BYN-3/CT		
787	2429	
2012		

अथर्व-वेदः

अनुसूची - १

अनुसंधान विभाग

BVN-3/CT

787

28 29

2012

૧. તોચનાઈ મુજબની ઝાંઝી
પરિચયો, માર્ગશીર્ષક



૨. તોચનાઈ મોંઘુનાઈ ટાપ
માર્ગશીર્ષક, માર્ગશીર્ષક



તોચનાઈ ટાપ કે સરકારી ટાપની વચ્ચેનાઈ ટાપની જાણે પીઠાઈ કે
પાને તોચનાઈ ટાપનાઈ માટે છે.

૩. N. M. Patel

૪. રાજીવ ગાંધી

તારીખ ૨૨ ૧૨ ૨૦૧૨ મુદત ૧૦૦૦

P. J. Rathod
સહ સચીવ
માર્ગશીર્ષક

અહીં ઉપર નક્કી કરેલ મોંઘુ
ફોન નં. ૧ ૨૪ મોંઘુ છે.
તારીખ : ૨૦/૦૨/૨૦૧૨

P. J. Rathod
સહ સચીવ
માર્ગશીર્ષક

BVN-3/CT		
787	૨૭	૨૭
2012		

નામ: નંબર: 787 તારીખ: ૨૭/૦૮/૨૦૧૨
--

[Signature]

P.J. Rathod

મુ. નિયામક,
મુ. નિયામક



